

:- આંક - ૧ હેઠળ હુકમ :-

(૧) હાલની અરજી અરજદારે સી.આર.પી.સી.કલમ-૪૫૧/૪૫૭ મુજબ ફોડની રકમ પરત મેળવવા માટે કરેલી છે. આ કામે કેસની ટુંકી હકિકત એવી છે કે અરજદારના યુનીયન બેંક ઓફ ઈન્ડિયા ના ખાતા નં. 520101199881452 માંથી રૂ.3125000/- રકમ સાયબર ફોડ ધ્વારા ઉપડી ગયેલ. રકમો પૈકીની રકમ રૂ.500000/- સામાવાળાના ધી કાલુપુર કોમીશીયલ કો.ઓ.બેક. ના ખાતા નં. 3210109763 માં ટ્રાન્સફર થયેલી. જેથી અરજદારે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા સામાવાળાનું બેંક ખાતું ફિઝ કરવામાં આવેલ છે અને તેમાં રહેલ બેલેન્સ રકમ રૂ.500000/-ફિઝ કરવામાં આવેલ છે જે રકમ અરજદારે હાલની અરજી ધ્વારા પરત માંગે છે જે અંગે પોલીસ ઈન્સ્પેક્ટર, નવરંગપુરા પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેરનો અભિપ્રાય મંગાવતા તેઓએ અભિપ્રાય મોકલી આપેલ છે કે, અરજદાર સાઈબર ક્રાઈમનો ભોગ બનેલ હોય ધી કાલુપુર કોમીશીયલ કો.ઓ.બેક. ને સામાવાળાનું ઉપરોક્ત ખાતું ફિઝ કરવામાં આવેલ છે અને તેમાં રહેલી અને ફિઝ થયેલી રકમ અરજદારને સુપરત કરવામાં આવે તો વાંધો નથી. વિશેષમાં ત.ક.અધિકારીએ જણાવેલ છે કે, સામાવાળાનું ખાતું બનાવટી હોવાનું જણાઈ આવે છે કારણ કે સદરહુ ખાતું સીઝ કર્યા બાદ ખાતેદાર કે અન્ય કોઈ વ્યક્તિએ ખાતું સીઝ કર્યા બાબત પોલીસ સમક્ષ કોઈ વાંધા-તકરાર લીધેલ નથી. આમ, ત.ક.અધિકારીના અભિપ્રાયને ધ્યાને રાખતાં જે ખાતામાં ફોડની રકમ ગયેલ છે તે ખાતું ફિઝ કરવા છતાં તે અંગે કોઈ ખાતેદારે વાંધો ઉઠાવેલ નથી જે પરથી જણાય છે કે આ ખાતું ફોડ કરવા માટે જ ખોલાવવામાં આવેલ હશે અને પોતાનું ફોડ પકડાઈ ન જાય તે માટે ખાતું સીઝ કરવા છતાં ખાતેદારે પોલીસનો સંપર્ક કરેલ નથી. જેથી પ્રથમદર્શનીય રીતે જણાય છે કે આ ખાતું ફોડ માટે જ ઓપન કરવામાં આવેલ હશે. જેથી આ ખાતામાં ફિઝ થયેલી રકમ અરજદારના ખાતામાંથી ફોડ ધ્વારા ટ્રાન્સફર થયેલ હોવાથી તે રકમ અરજદારના ખાતામાં પુનઃ ટ્રાન્સફર કરવી જરૂરી છે અને તે રકમ અરજદારને તે રીતે પરત કરવી ન્યાયી અને યોગ્ય જણાય છે જેથી આ અરજી હેઠળ નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

:: હુકમ ::

૧. સામાવાળાનું ઉપરોક્ત ખાતું સાયબર ક્રાઈમ ધ્વારા સીઝ કરી તેમાં રહેલ રકમ ફિઝ કરવામાં આવે છે જે ખાતાની બેલેન્સ રકમ રૂ. 500000/-અરજદારના યુનીયન બેંક ઓફ

ઈન્ડિયા ના ખાતા નં. **520101199881452** માં ટ્રાન્સફર કરવા માટે ધી કાલુપુર કોમીશીયલ કો.ઓ.બેક. ને આદેશ કરવામાં આવે છે.

૨. સામાવાળાનુ ઉપરોક્ત ખાતુ ફ્રિઝ કરેલ હોવાથી અરજદારના ખાતામાં ઉપરોક્ત રકમ ટ્રાન્સફર કરવા પુરતુ આ ખાતુ એકટીવ કરવુ અને ઉપરોક્ત રકમ અરજદારના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા બાદ આ ખાતુ કાયમી માટે કલોઝ કરવાનો આદેશ ધી કાલુપુર કોમીશીયલ કો.ઓ.બેક. ને કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં આ ખાતા ધ્વારા અન્ય લોકોની સાથે ફ્રોડ કરવામાં આવે નહિ.

૩. આ હુકમની અમલવારી કરવા માટે પોલીસ ઈન્સ્પેક્ટર, નવરંગપુરા પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેરનાઓએ અરજદાર તથા સામાવાળાની બેંક સાથે સંકલનમાં રહી હુકમની અમલવારી કરવી.

હુકમ આજરોજ તારીખ ૧૪ મી, માહે. સપ્ટેમ્બર, સને-૨૦૨૪ ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી સહી કરીને જાહેર કર્યો.

તા.૧૪-૦૯-૨૦૨૪
અમદાવાદ શહેર.

(વી.એ.ધાધલ)
ફટ્ટા એડી. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ
અમદાવાદ શહેર.